



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૮/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૨૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૭ કેસ કરી, ૫૨ વ્યક્તિઓને ઝડપી, ૧૭૩ લીટર દેશી દારૂ, ૯૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪ બિયર ટીન, ૧ કાર અને ૨ સ્કૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૧૫ કેસ કરી, ૧૪૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫,૯૦,૨૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૨૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૨૨/૧૯

શહેરકોટડા: પુષ્પાબહેન વા/ઓ પુનમભાઈ પટણી (ઉ.વ.૨૮) (રહે.જજ સાહેબની ચાલી, ન્યુ મહાદેવનગર સોસાયટી સામે, શારદાબેન હોસ્પિટલ પાછળ સરસપુર) તા.૨૧/૦૮/૧૯ સાજના ૫/૪૫ વાગ્યાના સુમારે ચામુડાબ્રીજ થી શટલ ઓટોરિક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં બેઠેલ ત્રણ પુરૂષોએ રિક્ષામાં બેસતા ફાવતુ નથી આ બહેનને ઉતારી દો તેમ કહેતા રીક્ષા ચાલકે પુષ્પાબહેનને નિર્મણપુરા ચાર રસ્તા તરફ બ્રીજ ઊતરતા રીક્ષા ઉભી રાખી ઉતારી દીધા હતા. દરમ્યાન પુષ્પાબહેનને શંકા જતા પાસેનું પર્સ ચેક કરતા પર્સમાંથી સોનાની કાનની કડી નંગ-૨ કિંમત રૂપિયા ૫૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૫,૮૦૦/- પર્સમાંથી ચોરી થયેલાનું જણાઈ આવતા આ અંગેની ફરીયાદ પુષ્પાબહેને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.પી.ચોધરી ચલાવે છે.

મેઘાણીનગર: સાવીત્રીબહેન વા/ઓ કીશનચંદ સોની (સીંધી) (ઉ.વ.૭૩) (રહે. સીંધી કોલોની સરદારનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૮/૧૯ બપોરના ૧૨/૩૦ થી ૧/૦૦ વાગ્યા દરમ્યાન સિવિલ હોસ્પિટલથી મેઘાણીનગર મેટલ બારી પાસે આવેલ મીના જ્વેલર્સ સુધીના રસ્તામા શટલ ઓટોરિક્ષાની મુસાફરી દરમ્યાન રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ સ્ત્રી-પુરૂષે સાવીત્રીબહેનની નજર ચુકવી જમણા હાથમા પહેરેલ એક સોનાની બંગડી કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.ડી.જાડેજા ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૧૪૨૩/૧૯

માધવપુરા: કોકીલાબહેન વા/ઓ અચલસિંહ રાહોડ (ઉ.વ.૫૬) (રહે.મનસુખપુરાની ચાલી,દરીયાપુર દરવાજા બહાર) એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૮/૧૯ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે અજાણ્યો પુરૂષ પાણી પીવાના બહાનુ કરી કોકીલાબહેનના ઘરની બહાર આવી પાણી માંગતા, કોકીલાબહેન પાણી આપતા હતા ત્યારે કોકીલાબહેનના ગળામાંથી સોનાનો દોરો પેડલ સાથે કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૨૪/૧૯

બાપુનગર: સીતારામ સ/ઓ દુર્ગાભાઈ કીર (રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ ભક્તિનગર હાઉસિંગ ભક્તેશ્વર મહાદેવ પાછળ બાપુનગર) એ તા.૨૧/૦૮/૧૯ રાતના ૧૧/૦૦ વાગે રહેણાંક નજીક સ્કોર્પિયો કાર નંબર આરજે ૦૧ યુએ ૪૪૪૫ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૨/૦૮/૧૯ સવારના ૬/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ સીતારામ કીર એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૨૫/૧૯

એલીસબ્રીજ: લલીતભાઈ સ/ઓફ માવજીભાઈ પરમાર (ઉ.વ.૩૫) (રહે. મહેનતપુરાના છાપરાં આંબાવાડી એલીસબ્રીજ) એ અગમ્ય કારણસર તા.૨૨/૦૮/૧૯ બપોરના ૧/૧૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી હીરાભાઈ મુળજીભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: રાકેશભાઈ રમણભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) (રહે.ગંગાનગર ઠક્કરનગર) એ અગમ્ય કારણસર તા.૨૦/૦૮/૧૯ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને એલ.આર.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૨/૦૮/૧૯ કલાક ૨/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કેશવભાઈ બબાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.